

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY
Diploma Engineering – SEMESTER – 2 (NEW) – EXAMINATION – Winter-2023

Subject Code: 4320002

Date: 31-01-2024

Subject Name: Engineering Mathematics

Total Marks: 70

Instructions:

1. Attempt all questions.
 2. Make Suitable assumptions wherever necessary.
 3. Figures to the right indicate full marks.
 4. Use of programmable & Communication aids are strictly prohibited.
 5. Use of non-programmable scientific calculator is permitted.
 6. English version is authentic.

Q.1 Fill in the blanks using appropriate choice from the given options.

14

(યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.)

1. Order of the matrix $\begin{bmatrix} 2 & 5 \\ 7 & 8 \end{bmatrix}$ is _____

- (a) 2×3 (b) 3×2 (c) 3×3 (d) 2×2

$$2. \quad \begin{bmatrix} 4 & 3 \\ 6 & 2 \end{bmatrix} + \begin{bmatrix} 1 & 5 \\ 5 & 8 \end{bmatrix} = \underline{\hspace{2cm}}$$

- (a) $\begin{bmatrix} 5 & 8 \\ 11 & 10 \end{bmatrix}$ (b) $\begin{bmatrix} 5 & 2 \\ 11 & 10 \end{bmatrix}$ (c) $\begin{bmatrix} 3 & 2 \\ 11 & 10 \end{bmatrix}$ (d) $\begin{bmatrix} 5 & 8 \\ 1 & 6 \end{bmatrix}$

3. Which of the following is a square matrix?

નીચેનામાંથી ક્યું શ્રેણિક યોરસ શ્રેણિક છે?

- (a) $\begin{bmatrix} 1 & 3 \end{bmatrix}$ (b) $\begin{bmatrix} 1 \\ 5 \end{bmatrix}$ (c) $\begin{bmatrix} 1 & 3 \\ 5 & 4 \end{bmatrix}$ (d) $\begin{bmatrix} 1 & 3 & 2 \\ 5 & 4 & 5 \end{bmatrix}$

4. If $A = \begin{bmatrix} 3 \end{bmatrix}$ and $B = \begin{bmatrix} 4 \end{bmatrix}$ then $A \cdot B = \underline{\hspace{2cm}}$

$$\text{જો } A = [3] \text{ અને } B = [4] \text{ તો } A \cdot B = \underline{\hspace{2cm}}$$

- (a) $\begin{bmatrix} 12 \\ 0 \end{bmatrix}$ (b) $[12]$ (c) $[12 \ 0]$ (d) $[3 \ 4]$

5. $\frac{d}{dx} \sin x =$ _____

- (a) $\cot x$ (b) $\tan x$ (c) $\sin x$ (d) $\cos x$

6. If $f(x) = e^x$ then $f'(0) = \underline{\hspace{2cm}}$

જેવી રીતે $f(x) = e^x$ અને $f'(0) = \underline{\hspace{2cm}}$

- (a) 0 (b) 1 (c) -1 (d) 2

7. If $y = x^2$ then $\frac{d^2y}{dx^2} = \underline{\hspace{2cm}}$

જેવી રીતે $y = x^2$ અને $\frac{d^2y}{dx^2} = \underline{\hspace{2cm}}$

- (a) $2x$ (b) 2 (c) 0 (d) x^2

8. $\int \cos x dx = \underline{\hspace{2cm}} + c$

- (a) $\sin x$ (b) $\tan x$ (c) $\cot x$ (d) $\cos x$

9. $\int_0^1 x dx = \underline{\hspace{2cm}}$

- (a) 0 (b) 1 (c) $\frac{1}{2}$ (d) $\frac{3}{2}$

10. $\int \frac{1}{1+x^2} dx = \underline{\hspace{2cm}} + c$

- (a) $\tan^{-1} x$ (b) $\sin^{-1} x$ (c) $\cos^{-1} x$ (d) $\sec^{-1} x$

11. Order of differential equation $\frac{dy}{dx} + xy = \sin x$ is $\underline{\hspace{2cm}}$

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + xy = \sin x$ ની ક્ષાળ $\underline{\hspace{2cm}}$ હૈ.

- (a) 2 (b) 1 (c) 3 (d) 4

12. Integration factor of $\frac{dy}{dx} + y = x$ is $\underline{\hspace{2cm}}$

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + y = x$ નો સંકલ્યકારક અવયવ $\underline{\hspace{2cm}}$ હૈ.

- (a) $\sin x$ (b) 1 (c) x (d) e^x

13. $i^2 = \underline{\hspace{2cm}}$

- (a) -1 (b) 1 (c) 0 (d) 4

14. $(2+3i) \cdot (2-3i) = \underline{\hspace{2cm}}$

- (a) 2 (b) 3 (c) 13 (d) 5

Q.2 (A) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

06

(1) If $A = \begin{bmatrix} 2 & 5 \\ -1 & 3 \end{bmatrix}$, $B = \begin{bmatrix} 5 & 8 \\ 4 & 6 \end{bmatrix}$ and $C = \begin{bmatrix} 4 & 2 \\ 1 & 5 \end{bmatrix}$ then find $2A + 3B - C$

જેવી રીતે $A = \begin{bmatrix} 2 & 5 \\ -1 & 3 \end{bmatrix}$, $B = \begin{bmatrix} 5 & 8 \\ 4 & 6 \end{bmatrix}$ અને $C = \begin{bmatrix} 4 & 2 \\ 1 & 5 \end{bmatrix}$ એવી રીતે $2A + 3B - C$ શુદ્ધિત કરો.

(2) If $M = \begin{bmatrix} 1 & 4 \\ 3 & 7 \end{bmatrix}$ and $N = \begin{bmatrix} 6 & 9 \\ 0 & 5 \end{bmatrix}$ then prove that $(M+N)^T = M^T + N^T$

જો $M = \begin{bmatrix} 1 & 4 \\ 3 & 7 \end{bmatrix}$ અને $N = \begin{bmatrix} 6 & 9 \\ 0 & 5 \end{bmatrix}$ તો સાબિત કરો $(M+N)^T = M^T + N^T$

(3) Solve differential equations (વિકલ સમીકરણ ઉકેલો) $\frac{dy}{dx} = 1+x+y+xy$

(B) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

08

(1) Solve equations $\begin{array}{l} 2x+3y=8 \\ 3x+4y=11 \end{array}$ using matrix method

શ્રેષ્ઠની મદદથી સમીકરણ $\begin{array}{l} 2x+3y=8 \\ 3x+4y=11 \end{array}$ ઉકેલો.

(2) If $A = \begin{bmatrix} 3 & 2 \\ 1 & 4 \end{bmatrix}$ and $B = \begin{bmatrix} 1 & 2 \\ 0 & 1 \end{bmatrix}$ then prove that $(A \cdot B)^T = B^T \cdot A^T$

જો $A = \begin{bmatrix} 3 & 2 \\ 1 & 4 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 1 & 2 \\ 0 & 1 \end{bmatrix}$ તો સાબિત કરો $(A \cdot B)^T = B^T \cdot A^T$

(3) If $A = \begin{bmatrix} 2 & 3 \\ -1 & 2 \end{bmatrix}$ then prove that $A^2 - 4A + 7I_2 = O$

જો $A = \begin{bmatrix} 2 & 3 \\ -1 & 2 \end{bmatrix}$ તો સાબિત કરો $A^2 - 4A + 7I_2 = O$

Q.3 (A) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

06

(1) Find derivative of $f(x) = e^x$ using definition of differentiation

$f(x) = e^x$ નું વ્યાખ્યાની મદદથી વિકલન કરો.

(2) If $y = \log x \cdot \sin x$ then find $\frac{dy}{dx}$ જો $y = \log x \cdot \sin x$ તો $\frac{dy}{dx}$ મેળવો

(3) Evaluate (સંકલન કરો) $\int \left(4^x + 3x^2 + \frac{2}{x} \right) dx$

(B) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

08

(1) If $y = e^{\tan x} + \log(\sin x)$ then find $\frac{dy}{dx}$

જો $y = e^{\tan x} + \log(\sin x)$ તો $\frac{dy}{dx}$ મેળવો

(2) The equation of motion of a particle is $s = t^4 + 3t$.

Find its velocity and acceleration at $t = 2$ sec

એક કણની ગતિનું સમીકરણ $s = t^4 + 3t$ છે. $t = 2$ સેકન્ડે તેનો વેગ અને પ્રવેગ મેળવો.

(3) Find the maximum and minimum value of the function $f(x) = 2x^3 - 3x^2 - 12x + 5$

વિધેય $f(x) = 2x^3 - 3x^2 - 12x + 5$ ની અધિકતમ અને ન્યુનતમ મૂલ્ય મેળવો.

Q.4 (A) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

06

(1) Evaluate (સંકલન કરો) $\int xe^x dx$

(2) Evaluate (સંકલન કરો) $\int \frac{dx}{9+4x^2}$

(3) Find complex conjugate of $\frac{1-i}{1+i}$

સંકર સંખ્યા $\frac{1-i}{1+i}$ ની અનુભવ્ય સંકર સંખ્યા શોધો.

(B) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

08

(1) Evaluate (સંકલન કરો) $\int_0^{\pi/2} \frac{\sqrt{\cos x}}{\sqrt{\cos x} + \sqrt{\sin x}} dx$

(2) Find the area of circle $x^2 + y^2 = a^2$ using integration.

સંકલનનો ઉપયોગ કરીને વત્તની $x^2 + y^2 = a^2$ નું ક્ષેત્રફળ શોધો

(3) Simplify (સાદૃ રૂપ આપો) $\frac{(\cos 3\theta + i \sin 3\theta)^{-4} \cdot (\cos \theta - i \sin \theta)^5}{(\cos 2\theta - i \sin 2\theta)^6 \cdot (\cos 12\theta + i \sin 12\theta)}$

Q.5 (A) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

06

(1) If $(3x-7) + 2iy = 5y + (5+x)i$ then find value of x and y

જે $(3x-7) + 2iy = 5y + (5+x)i$ તો x અને y ની કિમત શોધો

(2) Convert $z = 1 + i\sqrt{3}$ into polar form. $z = 1 + i\sqrt{3}$ ને પ્રૂવિય સ્વરૂપમાં ફેરબો.

(3) Express $\frac{4+2i}{(3+2i)(5-3i)}$ in $a+ib$ form.

$\frac{4+2i}{(3+2i)(5-3i)}$ ને $a+ib$ સ્વરૂપમાં ફેરબો.

(B) Attempt any two (કોઈપણ બે ના જવાબ આપો)

08

(1) Solve differential equations (વિકલ સમીકરણ ઉકેલો) $\frac{dy}{dx} + 2y = 3e^x$

(2) Solve differential equations (વિકલ સમીકરણ ઉકેલો) $\frac{dy}{dx} = (x+y)^2$

(3) Solve differential equations (વિકલ સમીકરણ ઉકેલો) $\frac{dy}{dx} + \frac{y}{x} = e^x, y(0) = 2$
